



રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

www.rbi.org.in

www.rbi.org.in/hindi

e-mail: helpprd@rbi.org.in

પ્રેસ રિલીઝ ડિવીઝન, સેન્ટ્રલ ઓફિસ, પોસ્ટ બોક્સ નં. 406, મુંબઈ 400001
ફોન : 2266 0502 ફેક્સ : 2266 0358, 2270 3279

20 મે, 2005

રિલીફ / સેવિંગ્સ બોન્ડ ધારકોને મુદ્દલ તથા વ્યાજના ભુગતાનમા
વિલંબ બદલ વળતર આપવામા આવશે.

આરબીઆઈ એ આજરોજ બેંકોને, રિલીફ તથા સેવિંગ્સ બોન્ડના ધારકોને પાકતી મુદ્દત કરતાં વિલંબથી મળતી મુદ્દલ તથા વ્યાજ બદલ થયેલા નુકશાનનું યોગ્ય વળતર આપવાની સુચના આપી છે. આ વળતર સામાન્ય બચત ખાતાના વ્યાજ દરો પ્રમાણે, વિલંબના દિવસો ગણી તે રીતે આપવામા આવશે. આરબીઆઈ એ જણાવ્યું હતું કે જો તેની પોતાની ઓફિસથી વિલંબ થશે તો તેઓ પણ આ રીતનું વળતર ચુકવશે.

આરબીઆઈ એ તેના સુચનમાં તેની વિવિધ કાર્યાલયો તથા અન્ય બેંકોને જણાવ્યું હતું કે આ પગલું રિલીફ / સેવિંગ્સ બોન્ડમા નાણા રોકતા રોકાણકારોના હિત મા લેવામાં આવ્યું છે.

આરબીઆઈ ની સુચના અનુસાર બેંકોએ વ્યાજની તારીખના એક મહિના પહેલા વ્યાજના વોરંટ્સ મોકલવાના હોય છે. પાકતી મુદ્દતે ક્યુમ્યુલેટિવ બોન્ડને પાકટ વેલ્યુય પણ અગાઉથી મોકલવાની હોય છે. જો બોન્ડ હોલ્ડર, બોન્ડની પાકટ મુદ્દત બાદ સિક્યુરિટી ડિસ્ચાર્જ કરે તો બેંકે બોન્ડ ધારકને ડિસ્ચાર્જ સિક્યુરિટી મળ્યાના 5 કામના દિવસોમાં પાકટ વેલ્યુ મોકલવાની રહેશે.

અલ્પના કિલ્લાવાલા
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ રિલીઝ : 2004-2005/1220